


કલમ ૪ (૧) (૫) (૧)

તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ સેલના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગત:-

- કાકરાપાર વિયરથી ઓ.એન.જી.સી. બ્રીજ સુધીના તાપી નદીના ૮૫ ક્રિ.મી. તટ લંબાઈમાં તાપી નદી ડાખા કાંઠે તથા તાપી નદી જમણા કાંઠે સ્થિત વિવિધ મલિન જળ આઉટલેટ્સને તાપી નદીમાં મલિન થતા અટકાવવા તથા જે માટે સુઆયોજિત રૂનેજ વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાની કામગીરી.
- સદર કુલ કામગીરી પૈકી સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા) હુદ વિસ્તારની કામગીરી સુરત મહાનગરપાલિકા ધ્વારા કરવામાં આવે છે.
- કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સુડા, સુરત મહાનગરપાલિકા વચ્ચે સંકલનની કામગીરી

વ્યવસ્થાતંત્ર : તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ સેલનું હાલનું વ્યવસ્થાતંત્ર નીચે મુજબ છે.



(એ) હૃયાત :—

ટર્શરી સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિગત. :—

(૧) બમરોલી ખાતે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ :—

૪૦.૦૦ એમ.એલ.ડી.

૭૫૭૨૮ ૩૦૦૩૪

(૨) ડિડોલી ટર્શરી સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ :—

૩૫.૦૦ એમ.એલ.ડી.

૪૦.૦૦ એમ.એલ.ડી. ક્ષમતા

કુલ ક્ષમતા :— ૧૧૫.૦૦ એમ.એલ.ડી.

સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિગત. :—

અ.નં. નામ

ક્ષમતા

(બી) પ્રગતિ હેઠળના સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો :—

(૧) વરાણી સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૫૧.૭૨ એમ.એલ.ડી.

(૨) પાસોદરા સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૧૦.૦૨ એમ.એલ.ડી.

(૩) કામરેજ સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૫૦.૦૮ એમ.એલ.ડી.

(૪) કોલી ભરથાણા સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૦.૩૬ એમ.એલ.ડી.

(૫) કુંગરા સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૦.૫૨ એમ.એલ.ડી.

(૬) ખોલેશ્વર સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૦.૩૮ એમ.એલ.ડી.

(૭) કઠોર સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૧૬.૦૦ એમ.એલ.ડી.

(૮) કરજાણ સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૦.૭૬ એમ.એલ.ડી.

(૯) ધોરણ પારડી સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૧૩.૧૮ એમ.એલ.ડી.

કુલ ક્ષમતા :— ૧૪૩.૦૩ એમ.એલ.ડી.

(સી) પૂર્ણ :—

(૧) વાલક સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૪૩.૨૩ એમ.એલ.ડી.

(૨) ભરથાણા સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૨૨.૭૦ એમ.એલ.ડી.

કુલ ક્ષમતા :— ૬૫.૯૪ એમ.એલ.ડી.

સુઅેજ પમ્પીંગ સ્ટેશનની વિગત. :—

(અ) હાલમાં કાર્યરત સુઅેજ પંપીંગ સ્ટેશન :—

વેસ્ટગોન (રાંદેર) :—

(૧)	પાલ-ગૌરવપથ સુઅેજ પમ્પીંગ સ્ટેશન	૩૫.૦૦ એમ.એલ.ડી.
-----	---------------------------------	-----------------